


મીણા ના બાળકો

Les enfants de cire

- ✎ Southern African Folktale
- ☞ Wiehan de Jager
- ➡ Darshan Soni
- 💬 Gujarati / French
- ❗ Level 2

(imageless edition)





એક દિવસ, એક સુખી કુટુંબ હતી.

...

Il était une fois une famille bien heureuse.

તેઓ એ કોઈ દિવસ ઝગડા ના કર્યા. તેઓ તેના
મા બાપ ને ઘર માં અને ખેત માં મદદ કર્યા.

...

Ils ne se disputaient jamais. Ils
aidaient leurs parents à la maison
et dans les champs.

પણ આગ પાસે જવા ની રજા નતી.

...

Mais ils n'avaient pas le droit de s'approcher d'un feu.

બધું કામ રતન કરવા નું હતું, કારણ કે તેઓ મીએ
થઈ બાળકો હતા!

...

Ils devaient faire tout leur travail
pendant la nuit. Puisqu'ils étaient
faits de cire !

પણ એક દિવસ, એક છોકરો ને બહારે તડકા માં
જવું તું.

...

Mais un des garçons désirait se
promener au soleil.

એક દિવસ તેને બહુ જવું તું. એના ભાઈઓ એને
ચેતવણી આપી...

...

Un jour son désir était trop
puissant. Ses frères l'avertirent...

પણ બહુ મોદું થયું! એ તાપ માં ઓળખી ગયો.

...

Mais c'était trop tard ! Il fonda au soleil brûlant.



એને જોય ને બીજા મીણા ના બાળકો ઉદાસ
હતા.

...

Les enfants de cire étaient si tristes
de voir leur frère fondre.

પણ તેઓ પાસે એક યોજના હતી. તેઓ મીણા
માં થી એક પક્ષી બનાવુ.

...

Mais ils firent un plan. Ils
façonnèrent le morceau de cire
fondue en oiseau.

પક્ષી ભાઈ લય ને એક ઊંચો પહાડ પર લય ગયા.

...

Ils apportèrent leur frère l'oiseau jusqu'au sommet d'une montagne haute.

જ્યારે સૂરજ ઉગવા માંડ્યું, એ ગીત ગાયું અને
ઉડી ગયો.

...

Et lorsque le soleil se leva, il
s'envola vers la lumière du matin
en chantant.



Storybooks Canada

storybookscanada.ca

મીણ ના બાળકો

Les enfants de cire

Written by: Southern African Folktale

Illustrated by: Wiehan de Jager

Translated by: (gu) Darshan Soni, (fr) Alexandra Danahy

This story originates from the African Storybook (africanstorybook.org) and is brought to you by Storybooks Canada in an effort to provide children's stories in Canada's many languages.



This work is licensed under a Creative Commons
[Attribution 3.0 International License](#).